



સીટી ઓફ બ્રેમ્પટનના રિક્વિઝિશન સેન્ટર્સ માટે રસીકરણના પુરાવાના સંબંધમાં અદ્યતન માહિતી

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (ઓક્ટોબર 19, 2021) – નવેમ્બર 1 થી, સીટી ઓફ બ્રેમ્પટનના રિક્વિઝિશન સેન્ટર્સમાં પ્રવેશતા 12 વર્ષ અને વધારે ઉંમરના બધાં મુલાકાતીઓ માટે રસીકરણનો પુરાવો આપવાની જરૂર પડશે.

આ બાબત રિક્વિઝિશન સેન્ટર્સમાં બધાં સહભાગીઓ અને પ્રેક્ષકોને લાગુ પડે છે, જેમાં જુવાનિયાઓ, કોચીસ, ઈન્સ્ટ્રુક્ટર્સ, સંભાળકર્તાઓ, સ્વયંસેવકો અને રમત અધિકારીઓ સામેલ છે. આ અદ્યતન માહિતી અન્ય મ્યુનિસિપાલિટીસને અનુરૂપ છે અને તેનાથી પીલના સક્રિય જુવાનિયાઓના રમતગમતના સમુદાયને સંરક્ષણ આપવામાં મદદ મળશે.

રસીકરણ પદ્ધતિઓનો સ્વીકાર્ય પુરાવો

બ્રેમ્પટન રિક્વિઝિશન રસીકરણ પદ્ધતિઓના નીચેના પુરાવાની સાથે સાથે એક વધુ અંગત ઓળખ માહિતી સ્વીકારશે:

1. રસીકરણ રસીની રસીદનો પુરાવો: આ [પ્રોવિન્સના બુકિંગ પોર્ટલ](#) પરથી, અથવા પ્રોવિન્સની વેક્સિન બુકિંગ લાઇનને 1.833.943.3900 નંબર પર કોલ કરીને મેળવી શકાય છે.
2. ઓન્ટેરિયોનું અધિકૃત QR કોડવાળુ સુધારેલું ડિજિટલ વેક્સિન રિસિપ્ટ સર્ટિફિકેટ: આ [પ્રોવિન્સના બુકિંગ પોર્ટલ](#) પરથી મેળવી શકાય છે. વધુ માહિતી [અહીં શોધી](#) શકાય છે.

કૃપા કરી નોંધી લેશો કે કર્મચારીઓએ પ્રારંભિક તપાસ પ્રક્રિયા (સ્ક્રીનિંગ પ્રોસેસ) શક્ય એટલી ઝડપથી આગળ વધતી હોવાની ખાતરી કરવા સંચાલનલક્ષી જરૂરિયાતોની સમીક્ષા કરવાનું ચાલુ રાખ્યું છે. અમે કહીએ છીએ કે તમે તમારી પ્રવૃત્તિ માટે વહેલાં આવવાનું આયોજન કરો જેથી જરૂરી તપાસો પૂરી કરવા સમય પૂરતો હોવાની ખાતરી કરી શકાય. અમે આ પ્રક્રિયા દરમિયાન તમારી ધીરજની કદર કરીએ છીએ.

છૂટછાટ

તબીબી છૂટછાટને લીધે રસી ન લઈ શકતી વ્યક્તિઓને પ્રવેશની પરવાનગી તબીબની નોંધથી આપવામાં આવશે જે COVID-19 રસીકરણમાં છૂટછાટ સ્પષ્ટપણે દર્શાવે.

કૃપા કરી નોંધી લેશો કે સંપૂર્ણ રસીકરણના પુરાવાના વિકલ્પ તરીકે COVID-19 ટેસ્ટના નેગેટિવ રિઝલ્ટનો પુરાવો સ્વીકારવામાં આવશે નહીં.

રસીકરણ કરાવો

તમે તમારું પોતાનું સંરક્ષણ કરો અને આપણાં સમુદાયનું સંરક્ષણ કરો. રસીકરણ કરાવવા પર વધુ માહિતી માટે, એપોઇન્ટમેન્ટ બુક કરાવવા સહિત, રીજીયન ઓફ પીલના રસીકરણ કેન્દ્રની મુલાકાત [અહીં](#) લો.

સામાન્ય પૂછપરછો માટે, કૃપા કરી recreation@brampton.ca ને ઈમેઇલ મોકલો અથવા સીટી ઓફ બ્રેમ્પટનની અંદરથી 311 (અથવા સીટી બહારથી 905.874.2000) નંબર પર કોલ કરો.

સીટીની COVID-19 સામે પ્રતિક્રિયા પર અદ્યતન માહિતી માટે [અહીં](#) ક્લિક કરો.

ਮਿਡਿਯਾ ਸੰਪਰਕ :

ਪ੍ਰਭਜੋਤ ਕੈਥ (Prabhjot Kainth)

ਕੋਰਡੀਨੇਟਰ, ਮੀਡਿਯਾ ਐਂਡ ਕਮਿਊਨਿਟੀ ਐਂਗੇਜਮੇਂਟ

ਸਟ੍ਰੈਟੇਜਿਕ ਕਮਿਊਨਿਕੇਸ਼ਨ

ਸੀਟੀ ਓਫ਼ ਬ੍ਰਾਮਪਟਨ

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca